

આરબીઆઈ / 2006-2007 / 262
ડિબીઓડી નં. બીએલ.બીસી 59 /22.01.010/2006/2007

ફેબ્રુઆરી 21, 2007

બધી શિડ્યૂલ કમર્શિયલ બેંકો
(આર.બી.આઈ.સીવાય)

માનનીય સાહેબશ્રી,

બેંકીંગ રેગ્યુલેશન ફેક્ટ, 1949નું સેક્શન-23 ડોર્સ્ટેપ બેંકીંગ

ઉપરના વિષયમાં તા. એપ્રિલ 30, 2005 ના અમારા સરકયુલર ડિબીઓડી નં. બીએલ.બીસી 59 /22.01.001/2004/2005 ના અનુસંધાનમાં બેંકોને તેમના ટેકની મંજૂરી સાથે, કસ્ટમરોના પ્રીમાઇસીજમાં સેવા પૂરી પાડવા માટે એક સ્કીમ બનાવવાની સલાહ અપાય છે અને તેને મંજૂરી માટે રીજર્વ બેંકને મોકલવી.

2. કસ્ટમરોના અધિકારો અને દેવાની બાબતે પારદર્શકતાની અભિગમમાં એકરૂપતા અને સમાવિષ્ટ જોખમોને સ્પષ્ટ પણે વર્ણવવાની ખાતરી કરવા, બેંકોએ અનુસરવા માટે સામાન્ય સિધ્યાંતો અને બઢો પોરામીટર્સ સ્થાપવાનું નક્કી થયું છે તેમજ તેના ગ્રાહકોને ડોર્સ્ટેપ સર્વીસીજ પૂરી પાડવાનું નક્કી થયું છે.તે મુજબ, બેંકો આ પત્ર સાથે જોડેલ માર્ગરેખાઓ પ્રમાણે તેમના બોર્ડની મંજૂરીથી તેમના કસ્ટમરોને ડોર્સ્ટેપ બેંકીંગ સર્વીસીજ આપવા એક સ્કીમ તૈયાર કરી શકે.
3. બેંકોનું નકલી નોટોના તેમજ હાઇનોમીનેશન નોટોના માર્કટમાં ફેલાવા તરફ પણ ધ્યાન દોરવામાં આવે છે. બેંકોને નકલીઅને મ્યુટીલેટેડ નોટો શોધવા માટે તેમના એજન્ટસને શિક્ષણ આપવા ધોરણે પગલા લેવાની પણ સલાહ અપાય છે. જેથી કરીને ગ્રાહકો સાથે વિવાદો અને છિત્રપીડી રોકી શકાય.
4. બેંકોને સીધી રીત કે એજન્ટો કારા ગ્રાહકોને તેવા વિવિધ જોખમોને ધ્યાનમાં લેવાની સલાહ અપાય છે. તેમજ આ માટે અસરકાર પગલા લેવાની સલાહ અપાય છે. બેંકો આ બાબતે તેના એજન્ટો અને ગ્રાહકોને કેશ લીમીટે સૂચિત કરવા વિચારી શકે.
5. અર્દ વાર્ષિક ધોરણો બોર્ડસ ઓફ બેંક્સ સ્કીમના ઓપરેશનને રીવ્યૂ કરી શકે, તેના ઓપરેશનના પ્રથમ વર્ષ દરમયાન અને પછી વાર્ષિક ધોરણો

તમારો વિશ્વાસુ,

(પી. વિજય ભારકર)
ચીફ જનરલ મેનેજર

અનેક્ષર (જોડાણ)

ડોર્સ્ટેપ બેંકિંગ માટેની માર્ગરેખાઓ

1. ઓફર થતી સેવાઓ

બેંકો તેના ગ્રાહકોને ડોર્સ્ટેપ પર નીચેની બેંકિંગ સર્વીસીઝ આપી શકે

(એ) કોર્પોરેટ કસ્ટમર્સ / ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ્સ / પીએસ્યુ

1. કેશનું પીકઅપ
2. સાધનોનું પીકઅપ
3. કાઉન્ટર પર મેળવેલ ચેક પર કેશની ડીલીવરી
4. ડીમાન્ડ રફાઇટસની ડીલીવરી

(બી) વ્યક્તિગત ગ્રાહકો / કુદરતી વ્યક્તિઓ

1. કેશના ઉપાડ
2. સાધનોનો ઉપાડ
3. ડીમાન્ડ રફાઇટસની ડીલીવરી

2. ડીલીવરીની માડેલીટીઝ

(એ) પોતાના કર્મચારીઓ કારા

(બી) એજન્ટ્સ કારા

જ્યાં બેંકો સર્વીસીઝની ડીલીવરી માટે એજન્ટની સેવા લે ત્યારે એ ખાતરી કરવી પડે કે બોર્ડ મંજૂર કરેલ પોલીસી એજન્ટના સીલેક્શન અને ફી / કમીશન વગેરેના પેમેન્ટ માટે બછોળા સિદ્ધાંતો સ્થાપે. બેંકો અમારા સરકૃપુલર ડીબીઓડી નં. બીપી. 40/21.04.158/2006-2007 તા. નવેમ્બર 3, 2006 ના કારા ઈશ્યુ થયેલ મેન્ટિંગ રીસ્ક્સ એન્ડ કોડ ઓફ કન્ડક્ટ ઇન આઉટ સૌર્સિંગ ઓફ ફાયનાન્સીયલ સર્વીસીઝની માર્ગરેખાઓને અનુસરી શકે અને ખાતરી કરે કે ડોર્સ્ટેપ બેંકિંગ સર્વીસીઝ આપતી વખતે તેમાં આપેલ સિદ્ધાંતોની સાથે સુસંગતતા છે.

3. ડીલીવરી પ્રોસેસ

1. કસ્ટમર પાસેથી મેળવેલ કેશ બેંકના વતી ઈશ્યુ કરેલ રીસીપ્ટ કારા એકનોલોજ કરી શકાય.
2. ગ્રાહક પાસેથી મળેલ કેશ કલેક્શનના ટાઇમ પર આધારિત, તે જ દિવસે કે પછીના કામકાજ દિવસે કસ્ટમરના અકાઉન્ટને કેડીટ કરી શકાય.
3. કસ્ટમરને કેડીટ તારીખ વિશે યોગ્ય સલાહ આપીને માહિતગાર કરવા જોઈએ.
4. ડીમાન્ડ રફાઇટની ડીલીવરી અકાઉન્ટને કેડીટ કરીને લખાણ / ચેકની મેળવણી પર આધાર રાખીને કરવી પડે ને કે ડોર્સ્ટેપ પર મેળવેલ નાણાં કે સાધનો રામે.
5. કેશ ડીલીવરી સર્વીસીઝ શાખા પર ચેકની રીસીપ્ટ સામે કોર્પોરેટ કલાયન્ટ્સ / પીએસ્યુ / ડિપાર્ટમેન્ટ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગર્વનમેન્ટ્સને આપી શકાય, ટેલીફોનિક વિનંતી સામે નહીં. આવી કોઈ સવલત, વ્યક્તિગત ગ્રાહકોને પ્રાપ્ય ન થાય.

4. રીસ્ક મેનેજમેન્ટ

એ ખાતરી થઈ શકે કે ગ્રાહક સાથે થયેલ કરાર બેંકના કન્ફોલ બધાર હોય તેવા સંજોગો હેઠળ ડોરસ્ટેપ સર્વીસીઝ આપવાની બેંકની નિર્ણયતા પર કોઈ કાયદાકીય કે નાણાકીય જવાબદારી મુક્તી નથી. સર્વીસીઝને માત્ર શાખા પર ઓફર થતી બેંકીંગ સેવાઓના વિસ્તરણ તરીકે જોઈ શકાય અને એ એજ પ્રમાણે હોવી જોઈએ જાણે કે ટ્રાન્ઝેક્શન્સ શાખા પર થતા હોય. કરાર ગ્રાહકને તેના ઘરઅંગણે સેવાઓની મારગ્રાહી કરવાનો અદ્વિકાર આપતો નથી.

5. પારદર્શકતા

ડોરસ્ટેપ સેવાઓ માટે કસ્ટમર પર મૂકાતા ચાર્જ્સ જો હોય તો તે બોર્ડ મંજૂર કરેલ પોલીસીમાં સમાવિષ્ટ થવા જોઈએ અને ગ્રાહક સાથે થયેલ કરારના ભાગથ્રે હોવા જોઈએ. ચાર્જ્સ ડોરસ્ટેપ સર્વીસીઝ આપતા બ્રોશર્સ પર સ્પષ્ટપણે દર્શાવેલ હોવા જોઈએ.

6. અન્ય શરતો

1. ડોર સ્ટેપ સર્વીસીઝ માત્ર એ ગ્રાહકોને અપાવી જોઈએ જેના કેસમાં ધોગ્ય કેવાયસી પ્રાચીઝર્સ અમારા સરકયુલર ડિબીઓડી નં. એઓમએલ બીસી 58/14.01.001/2004-05 તા. નવેમ્બર 29, 2004 માં નક્કી કરેલ પ્રમાણે હોય અને જેમાં આ વિષય પરના સબસીકવન્ટ સરકયુલર્સ અનુસરાયા હોય.
2. સેવાઓ ગ્રાહકની ઓફિસ કે રહેઠાણ પર અપાવી જોઈએ, જેના સરનામા સ્પષ્ટ પણે કરારમાં નિર્દેશાયા હોવા જોઈએ.
3. ગ્રાહક સાથેની સમજૂતી / કરાર સ્પષ્ટ પણે સૂચિત કરે કે બેંક તેના એજન્ટના કમીશન અને ઓફીશન માટે જવાબદાર રહેશે.
4. સ્કીમ કોઈ નિષ્ઠિત ગ્રાહક કે ગ્રાહકોના વર્ગ સુધી સીમિત ન હોવી જોઈએ.
5. બેંકો આઉટસોર્સ થયેલ સેવાઓના પેમેન્ટ કરતી વખતે બેંકીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના સકેશન 10(1)(બી) (2)(બી) કારા લદાપેલ મર્યાદાઓને ધ્યાનમાં રાખી શકે.

7. અસંતોષનું નિરાકરણ

- (એ) બેંક આંતરિક રીતે તેના એજન્ટસ કારા અપાયેલ સેવાઓ વિશેની ફરિયાદો નિરાકરણ માટે એક ધોગ્ય ગ્રીવન્સ રીડ્ઝસલ મશીનરી બનાવવી જોઈએ. બેંક ના નિયુક્ત થયેલ ગ્રીવન્સ રીડ્ઝસલ ઓફીસરના નામ અને ટેલીફોન નંબર ગ્રાહકોને બેંકની વેબસાઈટ સહિત ઓવેલબલ કરાવા જોઈએ. નિયુક્ત ઓફીસરે ખાતરી કરવી પડે કે ગ્રાહકોના સાચા અસંતોષનું તત્કાલ નિરાકરણ થાય.
- (બી) જો કોઈ ગ્રાહકને લાગે કે તેની ફરિયાદ સંતોષજનક રીતે સંભોધાઈ નથી તો તેની પાસે તેની ફરિયાદના નિરાકરણ માટે લાગતા વળગતા બેંકીંગ ઓમબડસમેન્ટની ઓફીસ પાસે જવાનો વિકલ્પ છે.